

સાફલ્યગાથા

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી (શેત્રુંજી નાં સામસામા કાંઠે આવેલ બે તાલુકા(પાલીતાણા અને ગારીયાધાર) ને જોડતા ટુંકા રસ્તા અને પુલની સાફલ્યગાથા



ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકામાં ભંડારીયા ગુજરડા રાણીગામ મુખ્ય જિલ્લા માર્ગ કક્ષાનો ૪.૩૦૫ કિ.મી. લંબાઈનો રસ્તો આવેલો છે. આ રસ્તો શેત્રુંજી નદીને ક્રોસ કરે છે. આ રસ્તાની હયાત સપાટી કાચી છે. આ રસ્તાનો એક છેડો દેપલા રાણીગામ રોડ નોનપ્લાન ગ્રામ્ય માર્ગહયાત સપાટી ડામર તથા બીજો છેડો નવાગામ ભંડારીયા સમઢીયાળા રોડ મુખ્ય જિલ્લા માર્ગ હયાત સપાટી ડામર ને મળે છે. આ રસ્તાની હેઠવાસમાં શેત્રુંજી નદી ઉપર ડેમ બાંધવામાં આવેલ છે. ડેમમાં પાણી ભરાવાને કારણે આ રસ્તાનો ઉપયોગ વર્ષનાં ૬ માસ સુધી બંધ થઈ જતો હોવાથી આ જગ્યાએ પુલ બાંધવાની જરૂરીયાત ઉપ્સ્થિત થયેલ. આ જગ્યાએ પુલ બનાવવા માટે તે વિસ્તારનાક્ષ્ લોકોની વર્ષોની માંગણી હતી. આ રસ્તા તથા પુલ નો પ્રથમ વાર વર્ષ ૨૦૧૦-૧૧ નાં બજેટમાં સમાવેશ કરવામાં આવેલ.

મંજુર થયેલ કામની ટુંકી વિગત નીચે મુજબ છે.

રસ્તાનું નામ	:-	કન્સ્ટ્રક્શન ઓફ ભંડારીયા ગુજરડા રાણીગામ રોડ (ગુજરડા રાણીગામ રોડ વીથ શેત્રુંજી બ્રીજ એપ્રોચ) કિ.મી. ૦/૦-૪/૩૦૫ તાલુકો :- ગારીયાધાર
રસ્તામાં કરવાની થતી લંબાઈ	:-	કિ.મી. ૦/૦ - ૪/૩૦૫ તથા શેત્રુંજી નદી ઉપર ૯૬ મીટર લંબાઈનો પુલ
બજેટ સદર	:-	બજેટ ઉચ્ચકજોગવાઈ સદરે સને ૨૦૧૦-૧૧
જોબ નંબર મંજુરીની તારીખ /રકમ	:-	વર્ષ ૨૦૧૦-૧૧ નાં બજેટ બુક પાના નં. ૪૭૫, નવી આઈટમ રૂ. ૨૪૦.૦ લાખ
તાંત્રીક મંજુરીની તારીખ/રકમ	:-	તા. ૧૮/૦૫/૨૦૧૧, રૂ. ૭૫૩.૦૦ લાખ.
એજન્સીનું નામ	:-	કુનાલ સ્ટ્રક્ચર ઇન્ડીયા પ્રા. લી. રાજકોટ.
ટેન્ડર મંજુરીની તારીખ / રકમ	:-	તા. ૧૯/૧૧/૨૦૧૧, ૧૭.૮૮% ઉંચા. રકમ રૂ. ૮૪૩.૮૮ લાખ
કામ શરૂ કર્યા તારીખ	:-	૨૯/૦૧/૨૦૧૨, સમય મર્યાદા ૧૮ માસ
કામ પુર્ણ થયા તારીખ	:-	૨૫/૦૭/૨૦૧૩
પુર્ણ થયેલ કામ ની કિંમત	:-	રૂ. ૮૪૬.૯૧ લાખ

આ રસ્તામાં શેત્રુંજી નદી ઉપર ૧૬.૦ મી. લંબાઈનાં એક એવા ૬ ગાળા નો ઓપનવેલ ફાઉન્ડેશન વાળો મેજર બ્રીજ, ખારી નદી ઉપર માઇગર બ્રીજ, નાળા, પ્રોટેક્ટીવ વોલ, બોક્ષશેલ તેમજ જમીન સંપાદન, માટીકામ, ૧૭.૫૦ સે.મી. મેટલીંગ, ૧૦.૦ સે.મી. જીએસબી, ૩૭.૫૦ મીમી બીયુએસજી, ૨૫.૦મીમી એસડીબીસી તથા જરૂરી રોડ ફર્નીશીંગ લેવામાં આવેલ છે.

આ રસ્તો થવાથી પાલીતાણા તાલુકાનાં 20 ગામો કે જેની આશરે વસ્તી 27879 અને ગારીયાધાર તાલુકાનાં 30 ગામો કે જેની આશરે વસ્તી 81360 ને આડકતરો લાભ થશે. આ રસ્તો ગારીયાધાર થી મહુવા તાલુકાને જોડતો ટુંકો રસ્તો છે. સુચીત પુલ થવાથી આ બન્ને તાલુકા વચ્ચેનું અંતર આશરે 7.20 કિ.મી. જેટલુ ઘટશે. જેથી ગારીયાધાર થી સોમનાથ અને મહુવા, રાજુલા તરફ જતા વાહનોનો સમય તથા ઇંધણમાં બચત થતાં આર્થિક લાભ થશે. ગારીયાધાર અને મહુવા તાલુકાનાં શેત્રુંજી કાંઠાનાં ગામડાઓ સામાજિક રીતે એક બીજા સાથે સંકળાયેલા હોવાથી આ પુલ થતા સામાજિક પ્રસંગોએ સરળતાથી એક બીજા ગામોએ જઈ શકશે.

શેત્રુંજી નદી પર સુચિત પુલનાં સ્થળની સ્થિતિ દર્શાવતો ફોટોગ્રાફ-1



શેત્રુંજી નદી પર સુચિત પુલનાં સ્થળની સ્થિતિ દર્શાવતો ફોટોગ્રાફ-2



પુલ તૈયાર થયા પછી ની સ્થિતિ દર્શાવતો ફોટોગ્રાફ-1



પુલ તૈયાર થયા પછી ની સ્થિતિ દર્શાવતો ફોટોગ્રાફ-2



પુલ તૈયાર થયા પછી ની સ્થિતિ દર્શાવતો ફોટોગ્રાફ-3

